

158  
ENG

**SEAT No.** \_\_\_\_\_

No. of Printed Pages : 3

Sardar Patel University  
B.Sc.(Sem.-II) Examination  
Wednesday , 27<sup>th</sup> March, 2019

**Subject:** Physics

Course: US02CPHY21

Mechanics-II, Basic Electronics

## **Title: Mechanics-II, Basic Electronics and Lasers**

**Time:** 02:00 PM to 05:00 PM

Total marks: 70

**N.B.: (i)** All the symbols have their usual meanings

(ii) Figures at the right side of the question indicate full marks

**Q-1. Multiple Choice Questions (Attempt All)**

(10)



(P.T.O)

1

**Q.2 Answer in brief (Attempt any Ten)**

(20)

- (1) State Gauss's Theorem for relation between volume integral and surface integral.
- (2) Define Reciprocal Vectors.
- (3) Explain equation of continuity briefly.
- (4) Write fundamental postulates for Special Theory of Relativity.
- (5) What is a Filter circuit? Write names of different types of filter circuits.
- (6) Write important characteristics of semiconductor diode.
- (7) What are the advantages of transistors over vacuum tubes?
- (8) What is Zener Effect?
- (9) What is Laser Pumping? Which are the methods used for achieving population inversion?
- (10) What is a metastable state?
- (11) Which are the fundamental modes of vibrations of  $\text{CO}_2$  molecules?
- (12) Draw schematic diagram for experimental set up to obtain Nd:YAG Laser.

**Q.3 (a) Explain vector triple product for three vectors.**

(06)

- (b) If three vectors  $\mathbf{A} = \mathbf{i} - \mathbf{j} + \mathbf{k}$ ,  $\mathbf{B} = \mathbf{i} + \mathbf{j} - \mathbf{k}$  and  $\mathbf{C} = \lambda\mathbf{i} - \mathbf{j} + \lambda\mathbf{k}$  are coplanar than  
find the value of  $\lambda$ .

(04)

**OR**

**Q.3 (a) Explain the relation between line integral and surface integral using Stoke's Theorem.**

(06)

- (b) If  $\mathbf{A} = 2xz^2\mathbf{i} - yz\mathbf{j} + 2xz^3\mathbf{k}$  than find the value of  $\nabla \times \mathbf{A}$  at the point (1,1,1)

(04)

**Q.4 (a) What are Galilean Transformation Equations. Derive Galilean Transformation**

(06)

Equation for velocity transformation and prove that acceleration is invariant under  
Galilean transformation.

- (b) According to Lorentz-Fitzgerald contraction, what will be the length( $L$ ) of a rocket ship  
travelling at  $0.5c$  if it's initial rest length( $L_0$ ) is 60m?

(04)

**OR**

**Q.4 What is Ether? Discuss with necessary diagram construction and working of**

(10)

Michelson-Morley experiment for detection of ether. Write negative results and analysis  
of Michelson -Morley experiment.

(2)

2/3

**Q.5** (a) Draw Half wave rectifier circuit and explain with appropriate waveforms its working (06)  
during positive and negative half cycle of input ac voltage .

(c) Write advantages of a Bridge Rectifier. (04)

**OR**

**Q.5** (a) Write a short note on Light Emitting Diode (LED) . (06)  
(b) Write three types of Transistor with appropriate diagram. (04)

**Q.6** (a) Discuss properties of Lasers in detail. (06)  
(b) Explain Spontaneous and Stimulated Emission of radiation. (04)

**OR**

**Q.6** (a) Write a short note on Holography. (06)  
(b) Write applications of Lasers. (04)

\*\*\*\*\* X \*\*\*\*\*

(3)

3/3



[158]  
[GU]

SEAT No. \_\_\_\_\_

No. of Printed Pages : 3

Sardar Patel University  
B.Sc.(Sem. II) Examination  
Wednesday , 27<sup>th</sup> March, 2019  
Subject: Physics  
Course: US02CPHY21  
Title: Mechanics-II, Basic Electronics and Lasers

Time: 02:00 PM to 05:00 PM

Total marks: 70

N.B.: (i) All the symbols have their usual meanings  
(ii) Figures at the right side of the question indicate full marks

પ્ર. 1 નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો : (10)

- (1) એકમ લંબાઈ ધરાવતા સદીશને \_\_\_\_\_ સદીશ કેહવાય છે .  
(a) શૂન્ય (b) એકમ  
(c) ડેલ (d) બેલ
- (2) જો  $\mathbf{A} = \mathbf{i} + \mathbf{j} - \mathbf{k}$ ,  $\mathbf{B} = \mathbf{j} + \mathbf{k}$  and  $\mathbf{C} = \mathbf{i} - \mathbf{j}$  હોય તો સમલંબ ઘન નું કેડ \_\_\_\_\_ હશે.  
(a) 3 (b) 0  
(c) 1 (d) 2
- (3) જો  $\operatorname{div} \mathbf{V} = \nabla \cdot \mathbf{V} = 0$  હોય તો  $\mathbf{V}$ ને \_\_\_\_\_ સદીશ કહે છે .  
(a) સોલેનોઇડલ (b) અભ્યમણીય  
(c) ભુમણીય (d) ટાયડલ
- (4) ગેલીલીયન રૂપાંતરણ અનુસાર \_\_\_\_\_ અચળ છે.  
(a) પ્રવેગ (b) વેગ  
(c) કાર્ય (d) બળ
- (5) વિશ્રિષ્ટ સાપેક્ષવાદ અનુસાર મુક્ત અવકાશમાં પ્રકાશ નો વેગ \_\_\_\_\_ છે .  
(a) અનંત (b) શૂન્ય  
(c) રેંગિન (d) અચળ
- (6) \_\_\_\_\_ નો ઉપયોગ AC વોલ્ટેજ નો DC વોલ્ટેજ માં રૂપાંતર કરવા માટે થાય છે.  
(a) ટ્રાન્સફોર્મર (b) અવરોધ  
(c) રેકટીઝાયર (d) પ્લોરીઝાયર
- (7) \_\_\_\_\_ ડાયોડ નો ઉપયોગ ડિસ્પ્લે યુનિટ માં થાય છે.  
(a) LED (b) પાવર  
(c) ઐનર (d) વેરેક્ટર

(P.T.O)

1

4/3

(8) કોમન એમ્પીટર ટ્રાન્ઝીસ્ટર માટે  $I_c$  અને  $I_b$  નો ગુણોત્તર \_\_\_\_\_ છે .

- (a) 1 (b) 1 કરતા વધારે
- (c) 0 (d) 1 કરતા ઓછો

(9) આઇન્સ્ટાઇન નો અવશોષણ ગુણાંક (coefficient of absorption) \_\_\_\_\_ દ્વારા દર્શાવાય છે.

- (a)  $B_{12}$  (b)  $A_{12}$
- (c)  $B_{21}$  (d)  $A_{21}$

(10) પ્રેરિત ઉત્સર્જન દરમ્યાન, જો  $N_2 > N_1$  હોય તો તે અવસ્થા ને \_\_\_\_\_ કેહવાય છે .

- (a) પોખ્યુલેશન રીવીઝન (b) પોખ્યુલેશન ડીવીઝન
- (c) પોખ્યુલેશન ઈન્વરઝન (d) પોખ્યુલેશન કોલીઝન

પ્ર.2 નીચેના પ્રશ્નોના ટ્રૂકમાં જવાબ આપો (કોઈપણ દસ) (20)

- (1) કદ સંકલન અને પૃષ્ઠ સંકલન વચ્ચે સમ્બન્ધ દર્શાવતો ગોસ નો પ્રમેય લખો ?
- (2) વ્યુલ્ફ (reciprocal) સદિશ ની વ્યાખ્યા આપો?
- (3) સાતત્ય સમીકરણ (continuity equation) ટ્રૂકમાં સમજાવો .
- (4) વિશિષ્ટ સાપેક્ષવાદના મૂળભૂત સિદ્ધાંતો લખો.
- (5) ફિલ્ટર પરિપથ કોણે કેહવાય? ફિલ્ટર પરિપથ ના પ્રકાર જણાવો.
- (6) અર્ધવાહક ડાયોડ ની મહત્વની લાક્ષણિકતાઓ જણાવો.
- (7) વેક્ટ્યુમ ટ્યુબ ની સરખામણી માં ટ્રાન્ઝીસ્ટર ના ફાયદા જણાવો.
- (8) એનર અસર કોણે કેહવાય ?
- (9) લેસર પરમાપ્રોગ કોણે કેહવાય? પોખ્યુલેશન ઈન્વરઝન મેળવવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ જણાવો.
- (10) મેટાસ્ટેબલ અવસ્થા કોણે કેહવાય ?
- (11)  $\text{CO}_2$  પરમાપ્રોગ ના મૂળભૂત કંપનો ના પ્રકાર જણાવો .
- (12) Nd:YAG લેસર મેળવવા માટે પ્રાયોગિક રેખાકૃતિ દોરો

પ્ર.3 (અ) ત્રણ સસદીશોનો સદિશ ગુણાકાર સમજાવો . (06)

(બ) જો  $\mathbf{A} = \mathbf{i} - \mathbf{j} + \mathbf{k}$ ,  $\mathbf{B} = \mathbf{i} + \mathbf{j} - \mathbf{k}$  and  $\mathbf{C} = \lambda \mathbf{i} - \mathbf{j} + \mu \mathbf{k}$  સમતલીય હોય તો  $\lambda$  નું મુલ્ય શોધો . (04)

અથવા

પ્ર.3 (અ) સ્લોપ ના પ્રમેય દ્વારા રેખીય સંકલન અને પૃષ્ઠ સંકલન વચ્ચેનો સંબંધ સમજાવો (06)

(બ) જો  $\mathbf{A} = 2xz^2\mathbf{i} - yz\mathbf{j} + 2xz^3\mathbf{k}$  હોય તો બિન્દ(1,1,1) પાસે  $\nabla \times \mathbf{A}$  નું મુલ્ય મેળવો . (04)

②

2/3

- પ્ર.4 (અ) ગેલીલીયન રૂપાંતરણ સમીકરણો કોને કેહવાય? ગેલીલીયન રૂપાંતરણ સમીકરણો ની મદદથી વેગ (06)  
 રૂપાંતરણ માટે નું સમીકરણ મેળવો તેમજ સાબિત કરો કે ગેલીલીયન રૂપાંતરણ દરમિયાન પવેગ  
 અચળ છે.  
 (બ) નિષ્ઠિય અવસ્થા દરમિયાન રોકેટ ની લંબાઈ( $L_0$ )  $60\text{m}$  હોય તો તે રોકેટ જ્યારે  $0.5c$  ના વેગ થી ગતિ કરતું  
 હોય ત્યારે લોરેનજી-ફીતજેરાલ સંકોચન સમીકરણ ની મદદ થી તેની લંબાઈ( $L$ ) શોધો. (04)

અથવા

- પ્ર.4 છથર કોને કેહવાય? છથર ની હાજરી ચક્કાસવા માટે યોગ્ય આકૃતિ દોરી માઈક્રોસ્ન્યુન-મોરલે પ્રયોગ (10)  
 ની રચના તેમજ કાર્યપદ્ધતિ સમજાવો. માઈક્રોસ્ન્યુન-મોરલે પ્રયોગ ના નકારાત્મક પરિણામો લખો તેમજ તે  
 પરિણામોનું વિઝ્લેષણ કરો.

- પ્ર.5 (અ) અર્ધ તરંગ રેક્ટીફાયર નો પરિપથ દોરો તેમજ યોગ્ય તરંગ અંગો ની મદદથી ac ઈનપુટ વોલ્ટેજ (06)  
 ના ધન અને ઋણ અર્ધ ચક દરમિયાન અર્ધ તરંગ રેક્ટીફાયર ની કાર્યપદ્ધતિ સમજાવો.  
 (બ) બ્રીજ રેક્ટીફાયરના ફાયદા જણાવો. (04)

અથવા

- પ્ર.5 (અ) લાઇટ એમ્બીટીંગ ડાયોડ(LED) પર ઢ્રેક નોંધ લખો. (06)  
 (બ) ટ્રાન્ઝિસ્ટરના પ્રકાર યોગ્ય આકૃતિ સાથે જણાવો. (04)

- પ્ર.6 (અ) લેસર ના ગુણધર્મો ની વિસ્તૃત ચર્ચા કરો. (06)  
 (બ) વિકિરણો માટે સ્વયંસ્કૃત ઉત્સર્જન અને પ્રેરિત ઉત્સર્જન સમજાવો. (04)

અથવા

- પ્ર.6 (અ) હોલોગ્રાફી પર ઢ્રેક નોંધ લખો. (06)  
 (બ) લેસરના ઉપયોગો જણાવો. (04)

X  
 ③

